

સીટી કાઉન્સિલ દ્વારા બ્રેમ્પટનના પ્રથમ ઓફ-ગ્રિડ ઓર્ગેનિક ફૂડ શેડને મંજૂરી

બ્રેમ્પટન, ઓન્ટારિયો (05 મે 2021) – આજે સિટી કાઉન્સિલે ઓફ-ગ્રિડ ઓર્ગેનિક ફૂડ શેડને મંજૂરી આપી હતી, જે એક એક સ્વયં-ટકાઉ રહેતી, શુદ્ધિકૃત ખોરાક પ્રણાલિ છે જે બ્રેમ્પટનના અનેક પરિવારો માટે ખોરાક ઉત્પન્ન કરશે. ફૂડ શેડ 8220 મિસિસોગા રોડ ખાતેના બ્રેમ્પટન ફાયર સ્ટેશન 212 પર છ મહિનાના પાયલટ તરીકે સ્થિત હશે જે આ ઉનાળે શરૂ થઈ જશે.

ઓફ-ગ્રિડ ઓર્ગેનિક ફૂડ શેડ નેચર હાર્મની દ્વારા પૂરું પાડવામાં આવશે અને તે એક શૂન્ય ઊર્જા ગ્રીનહાઉસ માળખું છે જે ફૂડ શેડમાંથી પાક પેદા કરશે અને તે રિજનરેશન આઉટરિચ કમ્યુનિટીને દાન કરાશે જેથી બ્રેમ્પટનના પરિવારોને ખવડાવી શકાય જે [2021 બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ](#)નો ભાગ છે.

આ નવીન તકનીકમાં પોતાની ઈકોસિસ્ટમ છે જેમાં સંયુક્ત રીતે ઓટોમેટેડ માટી, હાયડ્રોપોનિક્સ, અને એક્વાપોનિક્સ સિસ્ટમો વપરાશે જેથી ખાવાલાયક ઓર્ગેનિક ફળ અને શાકભાજી અને ખાવાલાયક માછલી પણ પેદા થઈ શકશે. આ શેડ શૂન્ય-બગાડ અને કાર્બન નેગેટિવ હશે જેને સૌર અને વાયુની પુનઃપ્રાપ્ય ઊર્જાથી ચલાવાશે જેનું બાંધકામ કઠોર શિયાળાને ખમી શકશે.

આ ટકાઉ ઈન્ડોર ફાર્મમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પ્રયોગોના સ્વીટ સાથેનું ટેબલેટ પણ સમાયેલ છે અને સાથે જ તમામ આશ્યક સામગ્રી જેથી તમામ વચના લોકો માટે ઈન્ટરેક્ટિવ લર્નિંગને પ્રોત્સાહિત કરી શકાય.

બ્રેમ્પટન કમ્યુનિટી ગાર્ડન્સ પ્રોગ્રામ [બ્રેમ્પટન ઓ ગ્રીન પર્યાવરણીય માસ્ટર પ્લાન](#) ના લક્ષ્યોને આગળ ધપાવે છે, જેના દ્વારા શહેરી કૃષિને શહેર માટેની એક તક તરીકે ટાંકવામાં આવી હતી. બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસે 2020ની સાલમાં પણ બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામમાં ભાગ લીધો હતો જ્યારે ટીમ દ્વારા પાકની પેદાશ કરીને નોંધપાત્ર માત્રામાં તેનું સમાજને દાન કર્યું હતું.

સુવાક્યો

"બ્રેમ્પટન સીટી કાઉન્સિલે બ્રેમ્પટનના પ્રથમ ઓફ-ગ્રિડ ઓર્ગેનિક ફૂડ શેડને મંજૂરી આપી જે બ્રેમ્પટન ફાયર સ્ટેશન 212 ખાતે સ્થિત હશે અને જેને સ્થળ પર રહેતા બ્રેમ્પટન ફાયર સ્ટાફ સપોર્ટ આપશે. અમને બ્રેમ્પટનમાં ટકાઉપણાના નવા મોડેલ્સને પ્રસ્થાપિત કરતા ગૌરવ થાય છે ખાસ કરીને જે આપણા રહેવાસીઓને અને 2050 સુધીમાં GHGને 80% જેટલા ઘટાડવાના પ્રવાસને સીધું સમર્થન આપે છે."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન એક હરિત શહેર છે અને અમે ખોરાકી સલામતી અને રહેવાસીઓની સિક્યોરિટી માટેના નવીનતમ ઉકેલોનું સ્વાગત કરીએ છીએ. ઓફ-ગ્રિડ ઓર્ગેનિક ફૂડ શેડ પોતાની ઊર્જા ઉત્પન્ન કરે છે અને શૂન્ય-બગાડ પાણાલિને જાળવે છે, વરસાદના પાણી લાભે છે તેમજ કાર્બનને કેદ કરીને તાજું ઓક્સિજન મુક્ત પણ કરે છે. શહેરી કૃષિનું આ એક સીમાચિહ્ન છે અને અમને તેનું નેતૃત્વ કરતા ગૌરવની લાગણી થાય છે."

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રમ્પટન

"બ્રમ્પટનના બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામના ભાગરૂપે આ ઓફ-ગ્રિડ ઓર્ગેનિક ફૂડ શેડ COVID-19ના આ સમયમાં અનેક રહેવાસીઓને મદદરૂપ થશે. આ સ્વયં-ટકી રહેતું, ઓર્ગેનિક ખોરાકી પેદાશ કરતું મોડેલ સ્થાનિક ધોરણે ખોરાક પેદા કરવાના માર્ગો અને જરૂરિયાત તથા મૂલ્યને નિદર્શિત કરે છે અને એક વધુ ટકાઉ ભવિષ્ય માટેના સાધનો અને જ્ઞાનથી આપણા સહુનું સશક્તિકરણ કરે છે."

- ડુગ વ્હિલાન્સ, સિટી કાઉન્સિલર, વોર્ડ 2 અને 6, પ્રમુખ, બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ, સિટી ઓફ બ્રમ્પટન

"સિટીના કર્મચારીઓ બ્રમ્પટનમાં ખોરાકી સલામતી અને પર્યાવરણીય ટકાઉપણાની તકો પ્રત્યે પ્રતિબદ્ધ છે. બ્રમ્પટન ફાયર સ્ટેશન 212 ખાતેના કર્મચારીઓને ઓફ-ગ્રિડ ઓર્ગેનિક ફૂડ શેડને સપોર્ટ કરવાની તાલીમ આપવામાં આવશે જેનાથી બ્રમ્પટનના સ્થિરતાના લક્ષ્યોને હાંસલ કરી શકાશે."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

"નેચર હાર્મની એક બિન નફાકારક સંસ્થા છે જેનું ધ્યાન પૃથ્વી પર અસરકારક કારભારને પ્રોત્સાહિત કરવા, સુલભ્ય બનાવવા અને સશક્તિકરણ કરવા પર કેન્દ્રિત છે. શહેર, સમુદાયો અને વ્યક્તિઓને પ્રકૃતિ અને આપણા વર્તમાન ઉપભોક્તાવાદી મોડેલો સાથેના તેમના સંબંધો પર ફરીથી વિચાર કરવા પ્રેરણા આપીને બ્રમ્પટન બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ અને બ્રમ્પટન ફાયર સાથેની ભાગીદારીમાં ઓફ-ગ્રિડ ઓર્ગેનિક ફૂડ શેડ પરિયોજના ટકાઉ અને ઉત્થાનની પહેલોને પ્રોત્સાહિત કરે છે."

- ફીલ ફુંગ, એગ્રિક્યુલ્ચર ડિરેક્ટર, નેચર હાર્મની

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સિટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca